

B.Com. Semester - 6 (CBCS) Examination
March/April-2025 (NEW COURSE)
Corporate Tax Planning-2 (Dse-1 (New))

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧ લિક્વિડેશનનાં સમયે મિલકતોનાં વિતરણનાં સંદર્ભ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ ઉદાહરણ સાથે (૨૦) સમજાવો.

અથવા

પ્રશ્ન-૧ કામદારોનાં મહેનતાણાનાં સંદર્ભ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ ઉદાહરણ સાથે સમજાવો.

પ્રશ્ન-૨ વીમા વળતરની રીસીપ્ટ સંદર્ભ સાથે ઉદાહરણ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ સમજાવો. (૨૦)

અથવા

પ્રશ્ન-૨ વૈજ્ઞાનિક સંશોધન મિલકતોનાં વેચાણનાં સંદર્ભ સાથે ઉદાહરણ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ સમજાવો.

પ્રશ્ન-૩ સમજાવો:-

1) એડવાન્સ રુલીંગ્સ (૦૮)

2) ડબલ ટેક્સેશન રિલિફ (૦૭)

અથવા

પ્રશ્ન-૩ ફેરબદલી કિંમત નિર્ધારણ નિયમન જોગવાઈ વિશે સમજાવો. (૧૫)

પ્રશ્ન-૪ વિસર્જનનાં સંદર્ભ સાથે કોર્પોરેટ ટેક્સ પ્લાનીંગ સમજાવો. (૧૫)

અથવા

પ્રશ્ન-૪ શાસક અને ગૌણ કંપનીઓ સાથે મિલકતોની ફેરબદલી વિશે સમજાવો.

ENGLISH VERSION

Que-1 Explain corporate Tax Planning with Reference to distribution of assets at the time of Liquidation with example. (20)

OR

Que-1 Explain corporate Tax Planning with Reference to Employees Remuneration with example.

Que-2 Explain corporate Tax Planning with Reference to Receipt of Insurance compensation with Example. (20)

OR

Que-2 Explain corporate Tax Planning with Reference to style of scientific Research assets with Example.

Que-3 Explain: -

1) Advance Rulings (08)

2) Double Taxation Relief (07)

OR

Que-3 Explain about provisions Regulating Transfer pricing. (15)

Que-4 Explain corporate Tax Planning with Reference of Demerger. (15)

OR

Que-4 Explain about Transfer of assets between holding and subsidiary companies.
